

સૌરાષ્ટ્ર યુનીવર્સિટી કેમ્પસની બહેનોની જાતીય સતામણી નિવારણ આંતરિક ફરિયાદ સમિતિ

સુપ્રીમ કોર્ટનાં આદેશથી અને યુજીસીની ગાઇડલાઇન અનુસાર સૌરાષ્ટ્ર યુનીવર્સિટી દ્વારા કેમ્પસ પરની બહેનોની જાતીય સતામણી સામે પ્રતિકાર કરવા એક સમિતિની રચના કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનીવર્સિટીની વિદ્યાર્થીનીઓ, મહિલા અધ્યાપકો તેમજ બિનશૈક્ષણિક કર્મચારી બહેનો સાથે કોઈપણ પ્રકારનો જાતીય સતામણીનો વ્યવહાર થયેલ હોય તો આ સમિતિને લેખિત રજૂઆત કરવી જરૂરી છે. સતામણીનો ભોગ બનનાર મહિલાનું નામ અત્યંત ગુપ્ત રાખવામાં આવશે. સમિતિ આ અંગે યોગ્ય તપાસ કરી કસુરવારને પુરતી સજા થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપે છે.

જો કોઈ બહેન પોતાનું નામ આપવા ઈચ્છતી ન હોય તો દરેક વિભાગ દ્વારા રાખવામાં આવેલ ડ્રોપ બોક્સમાં પોતાના નામ વગર લેખિત જાણકારી આપશે તો પણ આવા નનામા પત્રો ઉપરથી સમિતિ શક્ય એટલી યોગ્ય તપાસ કરવાના પુરા પ્રયત્ન કરશે.

જાતીય સતામણીમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.

(૧) શારીરિક છેડછાડ કે તેને પ્રોત્સાહન આપવું.

(૨) જાતીય વ્યવહાર માટે માંગણી કે વિનંતી કરવી.

(૩) અશ્લીલ કે દ્વિઅર્થી ભાષા વાપરવી.

(૪) અશ્લીલ સાહિત્ય બતાવવું કે વંચાવવું.

(૫) મોબાઈલ દ્વારા અશ્લીલ ચિત્રો કે લખાણ મોકલવા.

(૬) નારીની ગરિમા તથા જાહેર સુરુચિ કે ઔચિત્ય ભંગ થાય તેવી વાણી કે વર્તનનો પ્રયોગ કરવો.

(૭) અન્ય કોઈ પણ શારીરિક, શાબ્દિક, અશાબ્દિક(ઈશારા), છેડછાડ કે અડપલાં કરવા.

ઉપરોક્ત બાબતો અંગે સમિતિના કોઈપણ સભ્ય સમક્ષ રજૂઆત કરવાથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

ક્રમ	સભ્યશ્રીનું નામ	ભવન / વિભાગ	સમિતિમાં હોદા	સંપર્ક નંબર
૧.	સી.એ. લીનાબેન ગાંધી	ઓડીટ વિભાગ	પ્રીસાઈડીંગ ઓફીસરશ્રી	૯૦૯૯૯૩૯૪૦૪
૨.	ડો.કલ્પાબેન એ. માણેક	ઈતિહાસ ભવન	સભ્યશ્રી	૯૬૮૭૬૯૨૯૪૩
૩.	ડો.મનીષ કે. શાહ	રસાયણશાસ્ત્ર ભવન	સભ્યશ્રી	૯૦૯૯૯૩૯૪૯૬
૪.	ડો.આરતીબેન ઓઝા	આંકડા વિભાગ	સભ્યશ્રી	૯૪૨૭૬૧૪૬૧૨
૫.	સુશ્રી. અલ્પનાબેન (હેલીબેન) ત્રિવેદી	મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ	સભ્યશ્રી	૯૮૭૯૦૦૯૯૨૯
૬.	ડો. વિમલભાઈ પરમાર	શ્રી કે. પી. શાહ લો કોલેજ, જામનગર	સભ્યશ્રી	૯૮૯૮૬૯૧૬૯૧

ઉપરોક્ત ઉપરાંત ફરિયાદ યુજીસીની વેબસાઈટ ઉપરના ફરિયાદ નિવારણ પોર્ટલ અને ટોલ ફ્રી નંબર પર પણ કરી શકાશે.

યુજીસીની વેબસાઈટ :

www.ugc.ac.in

ટોલ ફ્રી નંબર : 1800 - 111 - 656